

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટનના અગ્નિશમનદલના વડા બિલ બોચ્ઝ થયા કેનેડાના ફાયર ચીફ ઓફ ટૂ યર

બ્રમ્પટન, ઓન્ટારિયો (13 સપ્ટેમ્બર 2021) – આજે, બ્રમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ (BFES) વડા બિલ બોચ્ઝને કેનેડિયન અસોસિએશન ઓફ ફાયર ચીફ્સ (CAFC) અને ફાયર ઉન્ડરરાઈટર્સ સર્વે ઓફ કેનેડા દ્વારા ફાયર ચીફ ઓફ ટૂ યર તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા. આ વાર્ષિક કાર્યક્રમ કેનેડાના સમસ્ત ફાયર સર્વિસીસ ઉદ્યોગમાં રહેલ ઉત્કૃષ્ટતાને માન્યતા આપે છે.

ચીફ બોચ્ઝની અગ્નિશમન કારકિર્દીની શરૂઆત બ્રમ્પટનમાં થઈ હતી જ્યાં તેઓ ફાયરફાઈટર તરીકે જોડાઈને પછીથી ક્રેપ્ટન બન્યા. તેઓ બ્રમ્પટનના અગ્નિશમનદલના વડા 2017થી રહ્યા છે, તેઓ તે વિભાગની એકધારી પ્રગતિ અને કેળવણીના સારથી રહ્યા છે અને સાથે જ તેમની અગ્નિશમન સુરક્ષા અને સેવાના ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો કાયમ રહ્યા છે. એકધારા વિકાસના પ્રબળ સમર્થક એવા ચીફ બોચ્ઝ અગ્નિશમન સેવાઓમાં વૈવિધ્ય, સમાનતા અને સમાવેશિતા સુધારવાની મહત્તા બરાબર સમજે છે અને તેઓ આ સંસ્કારોનું સિંચન ચાલુ રહેતી તાલીમની તકો અને જાહેર જનતા માટે ઓનલાઈન કારકિર્દીના માહિતી સત્રો મારફતે કરતા રહ્યા છે.

COVID-19 મહામારીની શરૂઆત થઈ ત્યારથી ચીફ બોચ્ઝ સમાજ આ પડકારનો સામનો કરે તેનું નેતૃત્વ પૂરું પાડ્યું છે. તેઓએ સિટીની ઈમર્જન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ ટીમમાં અગ્ર ભૂમિકા બજાવીને પોતાની અગ્નિશમનદલના વડા હોવાની ભૂમિકા પણ સુંદર રીતે ભજવી શક્યા છે.

ચીફ બોચ્ઝ ઈનોવેશનના ખરા અર્થમાં હિમાયતી રહ્યા છે અને તેઓ BFES અને શહેર પોતાના વિભાગના ફાયર માસ્ટર પ્લાન મારફતે સફળતાને વરે તે માટે એકધારું કાર્ય કરી રહ્યા છે. આ વર્ષે બ્રમ્પટન સીટી કાઉન્સિલે BFESની યોજનાઓને મંજૂર કરી જેમાં ફ્રન્ટ લાઈન પમ્પરની અવેજમાં સંપૂર્ણપણે વિજ્ઞાણ શક્તિથી ચાલતી ફાયર ટ્રક લાવીને બ્રમ્પટન ગ્રીન સિટી હોવાથી ગ્રીનહાઉસ વાયુને ઘટાડવાના ધ્યેયમાં યોગદાન આપ્યું છે.

ચીફ બોચ્ઝ એક સમર્પિત અને કોર્પોરેશનના માનનીય સભ્ય છે જેઓને કાઉન્ટઆઉટ રોવેના સેન્ટોસ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતાં અને જેમને સિટીની સમગ્ર નેતાગીરીનો તેમજ અસંખ્ય સહકાર્યકરોનો ટેકો પ્રાપ્ત હતો - સમાજની અંદર તેમ જ બહારથી જેમાં પીલ રિજનલ પોલિસના વડા નિશાન દુરાઈઅપ્પાનો પણ સમાવેશ થાય છે.

સુવાક્યો

"ચીફ બોચ્ઝને આ સુયોગ્ય પુરસ્કાર માટે અભિનંદન. અમારી નેતાગીરીના તેઓ મૂલ્યવાન સભ્ય છે જે એવી દરેક બાબત માટે સમર્પિત છે જેને માટે વડા હોવાની ભૂમિકા બની છે; તેઓ સમાજના નિર્માતા છે, સલામતીના હિમાયતી છે અને સાથે જ એક વિચારક અને કડ્ડણા ધરાવતા અગ્રણી છે. 2017થી ચીફ બોચ્ઝે બ્રમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસને એક અગ્ર વિચારસરણી ધરાવતી આધુનિક ટીમ બનાવી છે જે આજે દેખાય છે અને અમે તેમની આવી અવિરત પ્રતિબદ્ધતા માટે તેમને વધાવી લઈને તેમનો આભાર માનીએ છીએ."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"ચીફ બોચ્ઝ થોભ્યા વિના પોતાની ફરજ ઉપરવટ જઈને નેતૃત્વ પૂરું પાડે છે અને જ્યારે સમાજને તેમની જરૂર છે ત્યારે તેમની સેવા કરે છે. તેઓ અગ્નિશમન સેવાઓમાં ઈનોવેશન લાવતા અગ્રણી છે અને એવી ટીમ નિર્માણ કરવા સમર્પિત છે જે સમાવેશિત, જોડાયેલી અને સુધારક વિચારસરણી ધરાવતી હોય. તેઓ એક સાચા આગેવાન તરીકેની છાપ ત્યારે ઊભરી આવે છે જ્યારે તેઓ બ્રેમ્પટનની ટીમ અને તેમના સહ કમિશ્નરો અને સમાજ સાથે સહયોગી અભિગમ અપનાવે છે."

- રોચેના સાન્નોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"ચીફ બોચ્ઝ એક અનુકરણીય નેતા છે જે અમારા હિંમત, વિશ્વાસ, કરુણા અને અખંડિતતાના કોર્પોરેટ મૂલ્યોને મૂર્તિમંત કરે છે. તેઓ આધુનિક વિચારસરણી ધરાવે છે અને સમસ્ત બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસની ટીમને ઉદ્યોગના અગ્રણી હોવાનું તેમજ સમાજના જવાબદાર સભ્યો હોવાનું પુરવાર કર્યું છે. ચીફ તમને અભિનંદન!"

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

"ચીફ બોચ્ઝ પોતાની ફરજને હંમેશા અગ્નિશમનદલના વડાની ભૂમિકા કરતાં પણ અગ્ર રાખી છે. COVID-19ના આગમન પછી તેમણે પોતાની ભૂમિકાને સહાયતાથી સ્વીકારી અને એક ઉત્કૃષ્ટ અને મજબૂત આગેવાન તરીકે ઊભરી આવ્યા જેમનું ધ્યાન સમાજની સુરક્ષા અને સુખાકારી પર કેન્દ્રિત હતું. હું તેઓના ઈમર્જન્સી સેવાઓના સાથીઓ સાથેના સહયોગની કદર કરું છું જેમાં સામેલ છે પીલ રિજનલ પોલિસ. આ સન્માન માટે વધુ લાયક કોણ હોઈ શકે."

- નિશાન દુરાઈઅપ્પા, ચીફ, પીલ રિજનલ પોલિસ

"2021 ફાયર ચીફ ઓફ ધ યર કારકિર્દી અને સંયુક્ત વિભાગો (Career and Composite Departments) તરીકે ચીફ બોચ્ઝની નિયુક્તિ માટે અમને ગર્વની લાગણી થાય છે. અગ્નિશમનના વડાની ભૂમિકામાં વ્યક્તિગત અને વ્યવસાયિક ઉત્કૃષ્ટતાના ઉચ્ચતમ ધોરણોની આવશ્યકતા તો હોય જ છે. જોકે, ફાયર ચીફ ઓફ ટ યર પુરસ્કાર માટે અમે એવી લાક્ષણિકતાઓની શોધ કરીએ છીએ જે આવા ઉચ્ચતમ ધોરણોથી પણ પર હોય. અને આવી ઉત્કૃષ્ટતાને વધાવી લેવાથી અમને બધાંને એક ઉજ્જવળ ભવિષ્યની પ્રેરણા મળે છે જે વધુ સારી સંભાવનાઓથી ભરેલું હોય, આ જ કાર્ય ચીફ બોચ્ઝ કરી રહ્યા છે. ચીફ બોચ્ઝ, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ અને સિટી ઓફ બ્રેમ્પટનને અભિનંદન. અમે આપ સહુ આગળ નતમસ્તક છીએ."

- ચીફ જોલ્ન મકિર્ની, પ્રમુખ કેનેડિયન અસોસિએશન ઓફ ફાયર ચીફ્સ, વ્હીસલર ફાયર ચીફ

"અસોસિએશન ઓફ ફાયર ચીફ્સ (CAFC) અને ફાયર ઉન્ડરરાઈટર્સ સર્વે ઓફ કેનેડા દ્વારા ફાયર ચીફ ઓફ ટ યર તરીકે પુરસ્કૃત થવું તે મારે માટે મોટું સન્માન છે. આ ભૂમિકામાં મારી સફળતા સમગ્રતયા બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસની ટીમના સમર્થન અને સફળતાને કારણે છે. સહયોગથી આપણે શું હાંસલ કરી શકીએ છીએ તેનો મને ગૌરવ છે અને બ્રેમ્પટન, આપણી અગ્નિશમન સેવા અને આવા જોરદાર સમાજને સેવા આપવી તે મારું સૌભાગ્ય છે."

- બિલ બોચ્ઝ, ચીફ, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈન્થ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca